

સંજીવની



દઈ, દવા અને કાંકરના કોરોનો વિપુલ વાંચન આપે છે...

આખી તંદુરસ્તીની માઈસ્ટરી...

હળદર અને સરસવના તેલથી મળશે અનેક ફાયદા

હળદર અને સરસવ તેલ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. જો આ બંનેને મિક્સ કરીને ખાવામાં આવે તો તેમા રહેલ ગુણ બમણા વધી જાય છે. આ મિક્ષરને એક ચમચી ઢુણા પાણી સાથે લેવાથી આરોગ્ય સાથે જોડાયેલ અનેક પ્રકારની સમસ્યાઓ અને બીમારીઓ દૂર થાય છે. આવા જાણીએ હળદર અને સરસવ તેલ મિક્સ કરીને ખાવાથી કયા કયા ફાયદા થાય છે.

- કુખાવડાનું રાહત** - હળદરમાં રહેલ કરકચુમિન દુખાવામાથી રાહત આપે છે. હળદર અને સરસવનું એલ મિક્સ કરીને ખાવાથી શરીરમાં દુખાવાની સમસ્યા દૂર રહે છે.
- દેહલી સ્કિન - હળદર અને

સરસવનું તેલ મિક્સ કરીને ખાવાથી લોહી શુદ્ધ થાય છે. તેનાથી પિથ્લસ, એકને, સ્કિન ઈર્કસ્ત્રાનની સમસ્યા દૂર રહે છે. સાથે જ ચહેરા પર ગ્લો આપે છે.

- હિવર ડિસીઝ - હળદર અને તેલ મિક્સ કરીને ખાવાથી શરીરમાં ટાંકિસ-સ બહાર નીકળે. તેનાથી બોડી ઈરેક્ટાશમાં સુધાર શકે અને હિવર ડિસીઝનો ખતરો ઓછો થાય છે.
- સ્કિન પ્રોબ્લેમ્સ - હળદર ખાવાથી સ્કિન ઈર્કસ્ત્રાન સારૂ રહે છે.

સોમવાર ૧૪ જાન્યુઆરી ૨૦૨૦

રસપદ કિસ્સાઓ

હોમિયોપેથિક ઠોક સરળઉપાર

જીઆર બિનો, કો. જનતાલ યોગદાતા

ભણપણી બપોર ને સવારે જાગ્યા ત્યાર થી જ ગરમી ની શરૂઆત... કચું કામ ના કરીએ તો પણ આપણે યાકી જઈએ, સુસ્તી રહ્યા કરે, કામ કરવાનું મન જ ના થાય, અને જેમને કામના હોય તેતો આખો દિવસ આપણી જેમ પડ્યા જ રહે. ભૂખ ઓછી થાય, ચોડું વધુ ખવાઈ જાય તો પેટમાં અકામખામ થાય, ગભરામણ થાય, છાતીમાં દુ:ખાવો થઈ આવે, શરીર તપી જાય, ગરમી લાગે, અશક્તિ લાગે, પાણીની તરસ વધુ લાગે અને વધુ પાણી પીવાઈ જાય તો ઝાડા થઈ જાય, ને ઓછું પાણી પીવાય તો પેશાબમાં અટકાવત થાય, કબજિયાત થાય.

હૃદય ને બળ આપે દ્રાક્ષ, દાડમ ને શેરડી

આયુર્વેદનું સમૂહ

વેદ મહેશ ગખાણી

બળપણી બપોર ને સવારે જાગ્યા ત્યાર થી જ ગરમી ની શરૂઆત... કચું કામ ના કરીએ તો પણ આપણે યાકી જઈએ, સુસ્તી રહ્યા કરે, કામ કરવાનું મન જ ના થાય, અને જેમને કામના હોય તેતો આખો દિવસ આપણી જેમ પડ્યા જ રહે. ભૂખ ઓછી થાય, ચોડું વધુ ખવાઈ જાય તો પેટમાં અકામખામ થાય, ગભરામણ થાય, છાતીમાં દુ:ખાવો થઈ આવે, શરીર તપી જાય, ગરમી લાગે, અશક્તિ લાગે, પાણીની તરસ વધુ લાગે અને વધુ પાણી પીવાઈ જાય તો ઝાડા થઈ જાય, ને ઓછું પાણી પીવાય તો પેશાબમાં અટકાવત થાય, કબજિયાત થાય.

ગઠીયો વાની દુ:ખાવાની સારવાર

સાઈકોથેરાપીસ્ટ

વલણો

વલણો : યુરિક એસીડ સામાન્ય રીતે મુઝ દારા બહાર નીકળી જાય છે પરંતુ વૃદ્ધિ થતા રક્તની દુધી કરે છે. તમા શરીરના અસ્થા અહારમાંથી પ્રાપ્ત સોડિયમ સાથે મળીને પગના અંગૂઠાની પાછળની હાડકું તમા પ્રથમ આંગળીની હાડકી વચ્ચેના સંધ્યાની અંદરના તરૂણાસિઓની પ્રથમ સોડિયમ બાઈયુરોના રૂપમાં સોડિયમ બાઈયુરોના રૂપમાં સોડિયમ આકૃતિ જેવા સ્ફટિકોના રચના ઉભાર, બુંદ કે ધબધાના રૂપમાં સંચિત થાય છે. જેને ગદા કહે છે. તેના પરથી તેનું નામ 'ગાઉટ' રાખેલ છે.

સી પ્રથમ હાથ પગની આંગળીઓમાં દુ:ખાવાની શરૂઆત થાય છે. સોજા, દુ:ખાવો વધતા સ્પર્શશીલ જતું રહે છે. 'ગાઉટ' રાખેલ છે.

સાઈકોથેરાપીસ્ટ : યુરિક એસીડ સામાન્ય રીતે મુઝ દારા બહાર નીકળી જાય છે પરંતુ વૃદ્ધિ થતા રક્તની દુધી કરે છે. તમા શરીરના અસ્થા અહારમાંથી પ્રાપ્ત સોડિયમ સાથે મળીને પગના અંગૂઠાની પાછળની હાડકું તમા પ્રથમ આંગળીની હાડકી વચ્ચેના સંધ્યાની અંદરના તરૂણાસિઓની પ્રથમ સોડિયમ બાઈયુરોના રૂપમાં સોડિયમ આકૃતિ જેવા સ્ફટિકોના રચના ઉભાર, બુંદ કે ધબધાના રૂપમાં સંચિત થાય છે. જેને ગદા કહે છે. તેના પરથી તેનું નામ 'ગાઉટ' રાખેલ છે.

સાઈકોથેરાપીસ્ટ : યુરિક એસીડ સામાન્ય રીતે મુઝ દારા બહાર નીકળી જાય છે પરંતુ વૃદ્ધિ થતા રક્તની દુધી કરે છે. તમા શરીરના અસ્થા અહારમાંથી પ્રાપ્ત સોડિયમ સાથે મળીને પગના અંગૂઠાની પાછળની હાડકું તમા પ્રથમ આંગળીની હાડકી વચ્ચેના સંધ્યાની અંદરના તરૂણાસિઓની પ્રથમ સોડિયમ બાઈયુરોના રૂપમાં સોડિયમ આકૃતિ જેવા સ્ફટિકોના રચના ઉભાર, બુંદ કે ધબધાના રૂપમાં સંચિત થાય છે. જેને ગદા કહે છે. તેના પરથી તેનું નામ 'ગાઉટ' રાખેલ છે.

સંકલ્પ અને જીવન સાફલ્ય

તપ એટલે સંકલ્પ, મુશ્કેલીઓનો નીડરતાથી સામનો કરવો તે. કોઈ એક ઉદ્દેશ્ય લેવ્ય - ધ્યેયને મેળવવા માટે માનવી સતતને સમર્પણ કરે છે. અને પ્રકારના કષ્ટો, દુ:ખો, યાતનાઓ સહન કરે છે, જેને તેતેલા અસરોથી, અસ્વસ્થ માર્ગમાં આવે તો પણ ગમચડા વિના તમામ પ્રકારની પ્રતિકુળતાઓનો કિંમતથી સામનો કરે છે. કોઈની પણ સહાયતા કે મદદની આશા રાખ્યા વિના પોતાના ધ્યેયને મક્કમ મનોબળથી પ્રદર્શવે વચનો રહે છે. કિંમત હારતો નથી અને જે મેળવવાનો છે જે લક્ષ્યને પ્રાપ્ત કરવાની છે તે મેળવીને જ રહે તો આપણે કહીએ છીએ મુખ્ય તપ કર્મ, યુગ સંકલ્પ કર્યો. હા ! એ તપ છે. એ જીવન સંકલ્પ છે. આ તપ - સંકલ્પ બે પ્રકારના છે. શારીરિક અને માનસિક પહેલાના યુગમાં સ્વયંચે ઈશ્વરની પ્રાપ્તિ માટે, મોક્ષ મેળવવા માટે જે તપ કરતાં તે શારીરિક તપ. જેમાં શરીરને કષ્ટ આપીને પણ ભક્તિમાં જ લીન રહેતાં, પ્રભુ ભજનમાં મસ્ત રહેતા. માનસિક તપ - સંકલ્પ જે વ્યક્તિ મનથી સતત તે વસ્તુ પ્રત્યક્ષ કરે છે. પ્રત્યક્ષ થાય કે મનથી લડતું એટલે જ તે વસ્તુ પોતાની લાગણીઓને સતત દબાવી દેતી હોય, સતતને સતત સમાધાન - ડગલે ને પગલે જિંદગી સાથે સમાધાન કરી જીવતી હોય તો તે માનસિક તપ - સંકલ્પ કરી રહી છે એમ કહેવાય. દુન્યામાં કષ્ટને સહન કરતાં તપ કરવા જરિયાદ કરવાને બદલે આતંકમાં જ રહી બીજાને આતંક આપવો એ તપ છે, સંકલ્પ છે. ઘણા માણસો આ બંને પ્રકારના સંકલ્પમાંથી પસાર થતા હોય છે, છતાં ચહેરા જુઓ તે સદાબહાર હોય. સદાય ખીલેલા, મહેક્કતા જહોય. આ જ સાચો સંકલ્પ છે કે તમે કોઈપણ પરિસ્થિતિમાં ડચ્ચા વિના ઝગમગતા રહો.

તપ એટલે સંકલ્પ, મુશ્કેલીઓનો નીડરતાથી સામનો કરવો તે. કોઈ એક ઉદ્દેશ્ય લેવ્ય - ધ્યેયને મેળવવા માટે માનવી સતતને સમર્પણ કરે છે. અને પ્રકારના કષ્ટો, દુ:ખો, યાતનાઓ સહન કરે છે, જેને તેતેલા અસરોથી, અસ્વસ્થ માર્ગમાં આવે તો પણ ગમચડા વિના તમામ પ્રકારની પ્રતિકુળતાઓનો કિંમતથી સામનો કરે છે. કોઈની પણ સહાયતા કે મદદની આશા રાખ્યા વિના પોતાના ધ્યેયને મક્કમ મનોબળથી પ્રદર્શવે વચનો રહે છે. કિંમત હારતો નથી અને જે મેળવવાનો છે જે લક્ષ્યને પ્રાપ્ત કરવાની છે તે મેળવીને જ રહે તો આપણે કહીએ છીએ મુખ્ય તપ કર્મ, યુગ સંકલ્પ કર્યો. હા ! એ તપ છે. એ જીવન સંકલ્પ છે. આ તપ - સંકલ્પ બે પ્રકારના છે. શારીરિક અને માનસિક પહેલાના યુગમાં સ્વયંચે ઈશ્વરની પ્રાપ્તિ માટે, મોક્ષ મેળવવા માટે જે તપ કરતાં તે શારીરિક તપ. જેમાં શરીરને કષ્ટ આપીને પણ ભક્તિમાં જ લીન રહેતાં, પ્રભુ ભજનમાં મસ્ત રહેતા. માનસિક તપ - સંકલ્પ જે વ્યક્તિ મનથી સતત તે વસ્તુ પ્રત્યક્ષ કરે છે. પ્રત્યક્ષ થાય કે મનથી લડતું એટલે જ તે વસ્તુ પોતાની લાગણીઓને સતત દબાવી દેતી હોય, સતતને સતત સમાધાન - ડગલે ને પગલે જિંદગી સાથે સમાધાન કરી જીવતી હોય તો તે માનસિક તપ - સંકલ્પ કરી રહી છે એમ કહેવાય. દુન્યામાં કષ્ટને સહન કરતાં તપ કરવા જરિયાદ કરવાને બદલે આતંકમાં જ રહી બીજાને આતંક આપવો એ તપ છે, સંકલ્પ છે. ઘણા માણસો આ બંને પ્રકારના સંકલ્પમાંથી પસાર થતા હોય છે, છતાં ચહેરા જુઓ તે સદાબહાર હોય. સદાય ખીલેલા, મહેક્કતા જહોય. આ જ સાચો સંકલ્પ છે કે તમે કોઈપણ પરિસ્થિતિમાં ડચ્ચા વિના ઝગમગતા રહો.

કામમાં માન રિશ્ત ચાર નહીં જે વધુ શાક લાગે જાય... કાચી કેરીને પાણીમાં બાઢી, મચળી ગોટલી દૂર કરી વેલવા કેરીના માવામાં યોગ્ય પ્રમાણે પાણીને કોલેરે કે સાકર સાથે તાજ, ચારોળી, રાજદામ, ઈલાયચી ઉમેરી બનાવેલો બાફલો - સરખત પીવાથી તરતજ શાક દૂર થાય છે.

ફેફકાઓ નહીં તરબૂચના બીયાંનાં દાણા ફાયદાકારી છે

આરોગ્યને લગતી દરેક પરેશાની દૂર કરેશું

રિલમ હિગર મેળવવી છે તો ગરમીમાં પીણું શરૂ કરો આ જ્યુસ રજુ કરવાનો સમય પાણી સિવાય પાણી પછી પછી કમાલ જુઓ. બે સમયે પાણીથી વધુ મહત્વના માવાના ફાયદા જાણો છો વરેલુ ઉપચાર - અનેક રોગોમાં ઉપયોગી અમીસી તરબૂચ તો તમે ખાતા હશો પણ તેના બીયાંનું શું કરો છો ? દેખીતું છે કે તમે અને ફેફકા દાહો કરો. પરંતુ એના લાભો જાણી પછી કદાચ તમે એવું નહીં કરો. તરબૂચના બીયાંને યાદીને ખાવ કે તરબૂચનો રસ પીને બીયાંના ફાયદા અકસ્માત છે. આર્ય, પોટેશિયમ અને વિટામિનથી ભરપૂર તરબૂચના બીયાં આરોગ્ય, ત્વચા અને વાળ માટે ખૂબ લાભદાયી છે. એમાં રહેલ કૅલ્શિયમ હૃદયની કામગીરી સામાન્ય રાખે છે. અને મેલાનિનનું કિરમિટોને આધાર આપે છે. તે હજર રંગો અને હાથપરને જન્મમાં પણ ઉપયોગી છે.

મીઠા માટે : ત્વચા સ્ફીક્રમણ આ ઉપયોગી છે. જો ખીલની સમસ્યા હોય તો, તરબૂચના બીયાંનું તેલ ચહેરા પર લગાવો. આ ચહેરાની ગદગદી અને બિચખને દહાવી પોરોને ખોલે છે અને ત્વચાને સુંદર બનાવે છે. **વાળ માટે લાભદાયક** : પ્રોટીન અને આવશ્યક પ્રમાણમાં એમિનો એસિડ હોવાથી તરબૂચનાં બીયાં વાળ માટે સમૃદ્ધ ઉપાય છે. એના બીજા ચાવીને ખાવાથી વાળ જડતી મજબૂત થાય છે.

વિભાજન દુ:ખ તણવા ઈર્ષાનું જનક છે મન: તેની ભ્રામકતા મિટાવો, પામો આત્માનેન્દ...

મનોરા

જાલકની ચાલુ ધણી બધી અપરતી ક્રીયાઓ સ્વયં સાચી કરે છે. આમાં પુરૂ થાય છે તેનો આપણે અભ્યાસ કરીશું. ... તો તે વધારે સમજમાં આવશે. ઉદાહરણ રૂપે કોઈ વ્યક્તિ સાચકલ ચલાવવાનું શીખે છે. હવે શરૂઆતમાં તે સમાન મનઃજન પુરુષો ઉપયોગ કરશે. તે બહુ જ દબાવી દે છે. આપોઆપ જ સ્વયંભૂ થયા કરે છે. એ રોગથી વધવાની ક્રીયા હોય કે રોગો કરવાની ક્રીયા ચાલુ હોય ગુઢિયો જીવનગામી કલ્યાણનો કે યાદોને મનાવવાથી હોય અથવા કોઈની જોડે કોઈ અગત્યના મુદ્દે વાતચીત કરતી હોય છતાં તેની સરોશીમાં લગભગ કોઈ ભુલો થતી નથી. એમને આપણે મોટા ભાગની ક્રીયાઓ કરતા હોઈએ છીએ તે દરમ્યાન જાગૃત મનજોડે ક્રીયાઓથી વિલકુલ અજાણ હોય છે. સાહે આપણે ભુતકાળની યાદોમાં ખોવાયેલા હોઈએ અથવા આવાનાં ભવિષ્ય માટે કોઈ પ્લાનિંગ કરીશ્યા હોઈએ... છતાં

આત્માનેન્દ...

કરતાં એકજાતની કુલાળતા કેળવી શકાય છે. હવે સમાન મનઃજન ઘ્યાન હોય છે. આવા લાભો આપણને મળવા માટે આપણને આરમણી પાન-૧૦૦ મીટર ચાલી જાય છે. સંતુલન જાળવવાનું શીખવા લાગે છે અને પછી એક સમયે એ આવે છે કે સમાન મનઃજન ગેજાહામીને પણ શરીર તેના હાથ પાન એને ઝાળોળ્યાને પુરા અભ્યાસના લીધે લાંબામાં લાંબા અંતર સુધી, પડી ગયા વગર કે સંતુલન જાળવવાનું આ સમયને સંપૂર્ણ કુલાળતાથી સાચાવે છે. અને છેલ્લે, તો મનજૂ ભલેને ગમે તેવા વિચારોનો પ્રયોગ કરાય છે, કોઈ અગત્યના કામની ઝીણવટવારે કરાય છે, પરંતુ સમાન મનઃજન સાચકલ ચાલતો રહે છે. આપોઆપ એક મારાનીહોય કે સમાનુ હોય કે ઘડતી વડાવાવોનીચીય તે બધું જ થયા કરે છે. અહીં સાચુઓ ધીમે ધીમે ટેપાઈ જાય છે કે શીખી જાય છે. શરૂઆતમાં સમાન અનુસંધાન પાના નં. ઉપર

કરતાં એકજાતની કુલાળતા કેળવી શકાય છે. હવે સમાન મનઃજન ઘ્યાન હોય છે. આવા લાભો આપણને મળવા માટે આપણને આરમણી પાન-૧૦૦ મીટર ચાલી જાય છે. સંતુલન જાળવવાનું શીખવા લાગે છે અને પછી એક સમયે એ આવે છે કે સમાન મનઃજન ગેજાહામીને પણ શરીર તેના હાથ પાન એને ઝાળોળ્યાને પુરા અભ્યાસના લીધે લાંબામાં લાંબા અંતર સુધી, પડી ગયા વગર કે સંતુલન જાળવવાનું આ સમયને સંપૂર્ણ કુલાળતાથી સાચાવે છે. અને છેલ્લે, તો મનજૂ ભલેને ગમે તેવા વિચારોનો પ્રયોગ કરાય છે, કોઈ અગત્યના કામની ઝીણવટવારે કરાય છે, પરંતુ સમાન મનઃજન સાચકલ ચાલતો રહે છે. આપોઆપ એક મારાનીહોય કે સમાનુ હોય કે ઘડતી વડાવાવોનીચીય તે બધું જ થયા કરે છે. અહીં સાચુઓ ધીમે ધીમે ટેપાઈ જાય છે કે શીખી જાય છે. શરૂઆતમાં સમાન અનુસંધાન પાના નં. ઉપર

ડેલ્થ ટીપ્સ-ઔષધીય ગુણોથી ભરપૂર છે કારેલા

કારેલા આપણા આરોગ્ય માટે લાભદાયી છે. ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ કારેલાને સેવવાથી આપણું આરોગ્ય સારું રહે છે. આમ તો ,લીલા શાકભાજીને આરોગ્ય માટે એક વધારાન ગણવામાં આવે છે. પરંતુ કારેલાની વાત જુદી છે. એની પ્રયોગ શાકભાજી સ્વચ્છ કરાય છે, પરંતુ કારેલાને સીધું સેવન આપણા શરીર માટે વધુ ફાયદાકારક છે. કારેલા પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરવામા મદદ કરે છે. કારેલાના ખાવાના ફાયદા વિશે જાણો

મહેસાણા, પાટણ, રાધનપુર, સિધ્ધપુર, ચાણસ્મા, ઉઠા, વિસનગર, કિંમતનગર, ખેડભટ્ટા

રખિયા



પાટણમાં આખલાએ ત્રણ જણાને અડફેટે લેતાં ધારપુર સિલીલમાં ખસેડાયા

પાટણ શહેરમાં રખસતા ઠોરોનો ત્રણ બજાર વિસ્તાર, મહોલ્લા- ખોપોમાં તેમજ અનેક સોભાષીઓની અંદર વધી જતાં શહેરીજનોને પરેશાન થઈ ચુક્યા છે. ક્યારેક ગાય કે આખલા યુધ્ધ રીંછે છે ત્યારે કોઈ ઠોરોએ અડફેટે લેતાં તેનો ક્યારેકાકા વિકાળી જતો હોય છે. તેમજ ક્યારેક રાહદારીને અડફેટે લેતાં તેને ગંભીર ઈજાઓ થાય છે. શહેરમાં સવારે યજુવાલકો ગાયોને ઢોલીને ગામમાં ચરવા માટે રખસતા કરી દે છે અને ભોગ બને છે શહેરીજનોની રખસતા ઢોલીના પ્રયત્ને પાલિકાએ અનેકવારે ઠોર પકડવાની પ્રવૃત્તિ શેરોરોથી ચલાવેલ પરંતુ બાદમાં પરિસ્થિતિ યથાવત બની રહેવા લાગી છે. ત્યારે લાંબાતરખ શહેરના કાછવાણા વિસ્તારમાં એક આખલાએ રાહદારીને અડફેટે લેતાં ધોલીલાલણ કરી દીધીલ- આ બનાવમાં ત્રણ જણાને ઈજા પહોંચી હતી. જિલ્લા મળતી વિગતો અનુસાર પાટણના કાછવાણામાં ગાય અને આખલાઓ વચ્ચે યુધ્ધ મેલાયું તો સવારે ઠોરમાંથી પસાર થતા એક ઠોરને આખલાએ અડફેટે લેતાં છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમજ વધુ ઈજાગ્રસ્ત ઠોરને બચાવવા જતાં અન્ય બે ઠોરોમાં પણ આખલાએ ઈજાઓ પહોંચાડતા તેઓને પાટણ નજીકની ધારપુર સિલીલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. કાછવાણા વિસ્તારના મહેસૂબબાઈ કલમબાઈ રોય (ઉ.વ.૪૫) ને ગંભીર ઈજાઓ થતાં તેઓ નીકળે ઢોલી પકાડ હતા. બાદમાં તેઓને ધારપુર સિલીલમાં ખસેડવામાં આવ્યા હતા. રખસતા ઠોરોને ઇખામાં પકડવાની પ્રક્રિયા પાલિકા દ્વારા શરૂ કરવામાં આવે તેવી ઠીકામાં ઉઠી છે.

ભદુરચરાજની રૂપેણ નદીમાં પાણી છોડવામાં નહિ આવતા ઉનાળુ પાક નિષ્ફળ જવાના ઝેદાણા

વિસ્તારમાં પાલિકાએ આખલાએ રાહદારીને અડફેટે લેતાં ધોલીલાલણ કરી દીધીલ- આ બનાવમાં ત્રણ જણાને ઈજા પહોંચી હતી. જિલ્લા મળતી વિગતો અનુસાર પાટણના કાછવાણામાં ગાય અને આખલાઓ વચ્ચે યુધ્ધ મેલાયું તો સવારે ઠોરમાંથી પસાર થતા એક ઠોરને આખલાએ અડફેટે લેતાં છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમજ વધુ ઈજાગ્રસ્ત ઠોરને બચાવવા જતાં અન્ય બે ઠોરોમાં પણ આખલાએ ઈજાઓ પહોંચાડતા તેઓને પાટણ નજીકની ધારપુર સિલીલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. કાછવાણા વિસ્તારના મહેસૂબબાઈ કલમબાઈ રોય (ઉ.વ.૪૫) ને ગંભીર ઈજાઓ થતાં તેઓ નીકળે ઢોલી પકાડ હતા. બાદમાં તેઓને ધારપુર સિલીલમાં ખસેડવામાં આવ્યા હતા. રખસતા ઠોરોને ઇખામાં પકડવાની પ્રક્રિયા પાલિકા દ્વારા શરૂ કરવામાં આવે તેવી ઠીકામાં ઉઠી છે.

ખાણસા
ભદુરચરાજ પંથકમાં મોટાભાગે ચોમાસું આપણિત ખેતી થાય છે. પરંતુ ઊંછલા દશકથી આ વિસ્તારમાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થતી હોઈ રૂપેણ અને પુષ્પાવતી નદીમાં પાણી છોડવામાં આવતાં ખેડૂતો ઉનાળુ પાક પણ છોડી શકે છે. દર વર્ષે જ્યાં સુધી આ વર્ષે પણ નદીમાં પાણી છોડવામાં આવતા ખેડૂતો દ્વારા ઉનાળુ બાજરી, રજકો અને ધાનચણા વગેરેનું મોટાપાયે વાવેલ છે.

મોઢેરા - મીઠી ધારીયાલ વચ્ચે આવેલી પુષ્પાવતી નદી પર ૧૩ કરોડના ખર્ચે પુલ બંધાશે

મોઢેરા મીઠી ધારીયાલ વચ્ચે આવેલી પુષ્પાવતી નદી ઉપર આઝાદીના ૭૦ વર્ષથી પુલ બનાવવાની માંગણી રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંતોષવામાં આવી છે. આ નદી ઉપર અંદાજિત રૂ. ૧૩ કરોડના ખર્ચે બંધાવાર પુલ માટેની ટેન્ડર પ્રક્રિયા હાલ ધરવામાં આવતાં આગામી ૨ વર્ષના ગણામાં આ પંથકના અક્ષર ૧૨ થી વધુ ગામોના લોકોને તેનો સીધો લાભ મળશે. મોઢેરા નજીકથી પસાર થતી પુષ્પાવતી નદી ઉપર હાલમાં માર્ગ કોચ- વેની સગવડ ૬૦ પરિમારે ચોમાસાની ઋતુમાં નદીમાં પૂર આવવાના કારણે મોઢેરાથી પશ્ચિમ દિશા તરફના આક્ષર ૨૦ ગામોના લોકોનો તાલુકા અને જિલ્લા મરાઠ સર્જાનો વાહન વ્યવહાર ૬૫ થઈ જાય છે. મોઢેરા ગામથી મોઢેરા અને નર્મદા નદીઓ વચ્ચે મોઢેરા મોર્ન મોર્ન જેવા પ્રસંગોએ લોકો મોર્નને ભેટવા દેવા હતા. ઊંછલા વાગે વર્ષોથી આ નદી ઉપર વર્ષોથી ધારદાર રજૂઆત મીઠી ધારીયાલ ગામના જાગૃત મહિલા સમયે દ્વારા કરવામાં આવી હતી. જે માંગણી સંતોષવા પુષ્પાવતી નદી ઉપર આખલાએ રાહદારીને અડફેટે લેતાં ધોલીલાલણ કરી દીધીલ- આ બનાવમાં ત્રણ જણાને ઈજા પહોંચી હતી. જિલ્લા મળતી વિગતો અનુસાર પાટણના કાછવાણામાં ગાય અને આખલાઓ વચ્ચે યુધ્ધ મેલાયું તો સવારે ઠોરમાંથી પસાર થતા એક ઠોરને આખલાએ અડફેટે લેતાં છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમજ વધુ ઈજાગ્રસ્ત ઠોરને બચાવવા જતાં અન્ય બે ઠોરોમાં પણ આખલાએ ઈજાઓ પહોંચાડતા તેઓને પાટણ નજીકની ધારપુર સિલીલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. કાછવાણા વિસ્તારના મહેસૂબબાઈ કલમબાઈ રોય (ઉ.વ.૪૫) ને ગંભીર ઈજાઓ થતાં તેઓ નીકળે ઢોલી પકાડ હતા. બાદમાં તેઓને ધારપુર સિલીલમાં ખસેડવામાં આવ્યા હતા. રખસતા ઠોરોને ઇખામાં પકડવાની પ્રક્રિયા પાલિકા દ્વારા શરૂ કરવામાં આવે તેવી ઠીકામાં ઉઠી છે.

રાધનપુરમાં વચગાળાના વકીલ મંડળની સૂંટણી : છ ઉમેદવારીઓ ભરાયા

રાધનપુરમાં રાધનપુર પ્રમુખ ડીનેશચંદ્ર સી.કક્કર, હરચંદભાઈ કે. પારસીયા, મહેસાણાઈ જે. કક્કર અને કલ્યાણભાઈ કે. કારિયાનો સમાવેશ થાય છે. ઊંછલા પાંચ વર્ષથી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભાગ્યભાઈ ભી. મકવાણા સર્વામયને સૂંટણી આવાતા હતા. છ ઉમેદવારીઓ ઉમેદવારી નોંધાવી છે. જેમાં હાલના પ્રમુખ ડીનેશચંદ્ર સી.કક્કર, હરચંદભાઈ કે. પારસીયા, મહેસાણાઈ જે. કક્કર અને કલ્યાણભાઈ કે. કારિયાનો સમાવેશ થાય છે. ઊંછલા પાંચ વર્ષથી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભાગ્યભાઈ ભી. મકવાણા સર્વામયને સૂંટણી આવાતા હતા. છ ઉમેદવારીઓ ઉમેદવારી નોંધાવી છે. જેમાં હાલના પ્રમુખ ડીનેશચંદ્ર સી.કક્કર, હરચંદભાઈ કે. પારસીયા, મહેસાણાઈ જે. કક્કર અને કલ્યાણભાઈ કે. કારિયાનો સમાવેશ થાય છે. ઊંછલા પાંચ વર્ષથી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભાગ્યભાઈ ભી. મકવાણા સર્વામયને સૂંટણી આવાતા હતા. છ ઉમેદવારીઓ ઉમેદવારી નોંધાવી છે.

ધી સ્ટ્રેટ ટ્રાન્સપોર્ટ કો.ઓ કેડિટ સોસાયટીની ઓડીટમાં ૭૭ હજારનું નુકશાન કરાયું

ધી સ્ટ્રેટ ટ્રાન્સપોર્ટ કો.ઓ કેડિટ સોસાયટીની ઓડીટમાં ૭૭ હજારનું નુકશાન કરાયું. ઓડીટમાં ૭૭ હજારનું નુકશાન કરાયું. ઓડીટમાં ૭૭ હજારનું નુકશાન કરાયું. ઓડીટમાં ૭૭ હજારનું નુકશાન કરાયું.

ભુવચરાજ ખાતે બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સાધન સહાય વિનામુલ્યે ભેટ



યાજ્ઞાપમ બહુસહાઈ ખાતે રવિવારે બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સાધન સહાય વિનામુલ્યે ભેટ વિતરણ કરવામાં આવ્યું. યાજ્ઞાપમ બહુસહાઈ ખાતે રવિવારે બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સાધન સહાય વિનામુલ્યે ભેટ વિતરણ કરવામાં આવ્યું.

સેન્સે ફાઈનાન્સ રૂ ૩ સ્કુલોના સત્ર શરૂ થયા પહેલા ઓડવાન્સ ફી વસુલી

પાટણ જિલ્લામાં ચાલતી સેન્સે ફાઈનાન્સ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક ૨૩ શાળાઓએ હજુ નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા પહેલાં વિદ્યાર્થીઓ પાસેથી ઓડવાન્સ ફી વસુલી લીધી છે. પાટણ જિલ્લામાં ચાલતી સેન્સે ફાઈનાન્સ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક ૨૩ શાળાઓએ હજુ નવું શૈક્ષણિક સત્ર શરૂ થયા પહેલાં વિદ્યાર્થીઓ પાસેથી ઓડવાન્સ ફી વસુલી લીધી છે.

નુગર બાયાપસાર્કલ પાસે લોડિંગ રિસ્કની ટકરે બાઈકસવાર બે જણને ઈજા

મહેસાણામાં નુગર બાયાપસાર્કલ પાસે લોડિંગ રિસ્કની ટકરે બાઈકસવાર બે જણને ઈજા. મહેસાણામાં નુગર બાયાપસાર્કલ પાસે લોડિંગ રિસ્કની ટકરે બાઈકસવાર બે જણને ઈજા.

મહેસાણામાં ફરિયાદો પાઠી ખેંચવાના મુદ્દે પાટીદારોની રેલી

મહેસાણામાં પાટીદારોની રેલી. મહેસાણામાં પાટીદારોની રેલી. મહેસાણામાં પાટીદારોની રેલી.

રાધનપુરના ગૌ સેવકોએ વાહરડાનો જીવ બચાવ્યો



રાધનપુરના ગૌ સેવકોએ વાહરડાનો જીવ બચાવ્યો. રાધનપુરના ગૌ સેવકોએ વાહરડાનો જીવ બચાવ્યો.

ઊંઠામાં ફુડ અને ડ્રગ વિભાગના દરોડામાં ભેળસેળ ચુકત હુરાનો જથ્થો જપ્ત

ઊંઠામાં ફુડ અને ડ્રગ વિભાગના દરોડામાં ભેળસેળ ચુકત હુરાનો જથ્થો જપ્ત. ઊંઠામાં ફુડ અને ડ્રગ વિભાગના દરોડામાં ભેળસેળ ચુકત હુરાનો જથ્થો જપ્ત.

સાબરકાંઠાના એન.એસ.જી. ક્માન્ડોનું મજબૂત મોબાઇલ ફાટમાં મોત

સાબરકાંઠાના એન.એસ.જી. ક્માન્ડોનું મજબૂત મોબાઇલ ફાટમાં મોત. સાબરકાંઠાના એન.એસ.જી. ક્માન્ડોનું મજબૂત મોબાઇલ ફાટમાં મોત.

૯.૯૭ કરોડના ખર્ચે પાટીદારના ૪૩.૧૨ કિમીના માર્ગોનું મજબૂતીકરણ કરાશે

૯.૯૭ કરોડના ખર્ચે પાટીદારના ૪૩.૧૨ કિમીના માર્ગોનું મજબૂતીકરણ કરાશે. ૯.૯૭ કરોડના ખર્ચે પાટીદારના ૪૩.૧૨ કિમીના માર્ગોનું મજબૂતીકરણ કરાશે.

